

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રેમ્પટને પ્રતિષ્ઠિત ફાઈનાન્સિયલ એવોર્ડ જીત્યો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 8, 2022) – સતત 20<sup>મી</sup> વર્ષે, સીટી ઓફ બ્રેમ્પટને યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડાના ગવર્નમેન્ટ ફાઈનાન્સ ઓફિસર્સ એસોસિએશન (GFOA) પાસેથી કેનેડિયન એવોર્ડ ફોર ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ (CAnFR) જીત્યો છે.

CAnFR એવોર્ડ જે શહેરના 2020 [વાર્ષિક નાણાકીય અહેવાલ](#) માટે આપવામાં આવે છે, તે ગવર્નમેન્ટ એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ રિપોર્ટિંગમાં ઉત્કૃષ્ટતાને ઓળખ આપે છે, અને સ્થાનિક સરકાર અને તેના સંચાલનની નોંધપાત્ર ઉપલબ્ધિને રજૂ કરે છે.

બ્રેમ્પટને કેનેડાના ચાર્ટર્ડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ્સ (CPA) નાં પબ્લિક સેક્ટર એકાઉન્ટિંગ બોર્ડ (PSAB) દ્વારા નિર્ધારિત જનરલી એસપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ (GAAP) ની લઘુત્તમ જરૂરિયાતો વટાવીને, અને પારદર્શકતા અને સંપૂર્ણ ખુલાસાની ભાવનાના મૂળમાં, વ્યાપક અને ઉચ્ચ-ગુણવત્તાનો વાર્ષિક નાણાકીય અહેવાલ તૈયાર કરીને CAnFR એવોર્ડ જીત્યો છે.

CAnFR એવોર્ડ પ્રોગ્રામ, ઉચ્ચ-ગુણવત્તાના નાણાકીય અહેવાલો પ્રકાશિત કરવા કેનેડામાં મ્યુનિસિપલ સરકારોને પ્રોત્સાહિત કરવા અને આ અહેવાલો તૈયાર કરતા અધિકારીઓ માટે ઝીણવટભરી ઓળખ અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવા, બનાવવામાં આવ્યો હતો.

પ્રોગ્રામના ઉચ્ચ ધોરણોને પહોંચી વળવા વાર્ષિક નાણાકીય અહેવાલનો નિર્ણય નિષ્પક્ષ કેનેડિયન સમીક્ષા સમિતિ સભ્યો કરે છે, જેમાં બ્રેમ્પટનના નાણાકીય કથનનો સ્પષ્ટપણે સંવાદ કરવા સ્વનાત્મક “પૂર્ણ ખુલાસાની ભાવના” દર્શાવવાનો અને સંભવિત વપરાશકારોને પ્રોત્સાહિત કરવાનો અને વપરાશકાર સમૂહો અહેવાલ વાંચવાનો સમાવેશ થાય છે.

### અવતરણો (ક્વોટ્સ):

“નાણાકીય અહેવાલના સંબંધમાં પ્રતિષ્ઠિત CAnFR એવોર્ડ જીતવાથી પૂર્ણ પારદર્શકતા અને નક્કર નાણાકીય વ્યવહારો પ્રત્યે આપણી કટિબદ્ધતા સ્વીકારવામાં આવે છે, અને આપણું રોકાણ આકર્ષવાનું ચાલુ છે ત્યારે બ્રેમ્પટનની સ્થિતિ મજબૂત બને છે. અમને ગૌરવ છે કે શહેરને સતત વીસમાં વર્ષે આ એવોર્ડ મળ્યો છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“CAnFR પ્રોગ્રામની કડક જરૂરિયાતોને પહોંચી વળવામાં આપણાં કર્મચારીઓની નોંધપાત્ર કટિબદ્ધતાની જરૂર પડે છે જેઓ આપણો વાર્ષિક નાણાકીય અહેવાલ બનાવવા સહયોગ કરે છે. અમને ગૌરવ છે કે બ્રેમ્પટને સતત વીસમાં વર્ષ માટે આ એવોર્ડ જીત્યો છે અને અમે આ અહેવાલ બનાવવામાં સામેલ સૌને અભિનંદન આપીએ છીએ.”

- *હરકિરત સિંઘ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“CAnFR એવોર્ડ સીટી ઓફ બ્રેમ્પટન અને તેના મેનેજમેન્ટની નોંધપાત્ર ઉપલબ્ધિને રજૂ કરે છે. બ્રેમ્પટન એક સુસંચાલિત શહેર છે, અને અમે પારદર્શકતા અને સંપૂર્ણ ખુલાસાના સિદ્ધાંતો પ્રત્યે કટિબદ્ધ છીએ. આ એવોર્ડ નાણાકીય અહેવાલ સંબંધમાં આપણાં કર્મચારીઓ અને શહેરના ઉચ્ચ ધોરણોની લેખિત ઘોષણા છે.”

- *પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઇન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)